




TEX INDUSTRIES LTD.



Blue Chip

Corporate Office : 15,16 & 17, Maker Chambers-III, 1st Floor, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai 400 021  
Tel.: 91 22 4353 0400 • E-mail : bluechiptex@gmail.com • Website : bluechiptexindustrieslimited.com  
CIN : L17100DN1985PLC005561

**Date: 4<sup>th</sup> November, 2020**

To,  
Dept. of Corporate Services (CRD)  
**BSE Limited**  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai – 400 001

**Scrip Code: 506981**

**Subject: Newspaper Advertisement pertaining to Meeting of the Board of Directors**

Dear Sirs,

In compliance with the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we hereby submit copy of newspaper advertisement published on 4<sup>th</sup> November, 2020 in newspapers viz. Business Standard (In English) and Western Times (In Gujarati) informing about the Board of Director's Meeting to be held through video conferencing on Thursday 12<sup>th</sup> November, 2020 at 3.00 p.m.

The aforesaid information is also available on the website of the Company at [www.bluechiptexindustrieslimited.com](http://www.bluechiptexindustrieslimited.com).

Thanking you,

Yours faithfully,  
**For Blue Chip Tex Industries Limited**

*Bhumit .M. Dharod*

**Bhumit .M. Dharod**  
**Company Secretary & Compliance Officer**  
**Membership No.: ACS 51555**



Encl.: a/a

Regd. Office : Plot No. 63-B, Danudyog Sahakari Sangh Ltd., Village Piparia, Slivassa - 396 230. Dadra & Nagar Haveli (U.T.)

Works : 63-B Danudyog Sahakari Sangh Ltd. Piparia, Slivassa - 396 230. Dadra & Nagar Haveli (U.T.) Tel.: 91 9904011553 • 9924422247

45 B, Government Industrial Estate, Village - Masat, Slivassa - 396 230. Dadra & Nagar Haveli (U.T.) • Tel.: 91 260 2640842

**PUBLIC NOTICE**

I Shri Kiran Balkrishna More (Mob. No.9619396840 ) Flat No.12/C/15 Kritika Nagri Niwara Co-op. Housing Society Ltd.,Plot No. 5/1, Goregaon (East), Mumbai-400 065, is for SALE urgently. Flat no.12/C/15 was allotted to me under reserved quota. those who are interested under reserved category are requested to contact me within 15 days for further negotiation urgently  
Date:-04.11.2020  
Sd/-  
Shri Kiran Balkrishna More

**HINDUSTAN MOTORS LIMITED**  
CIN: L34103WB1942PLC018967  
Regd. Office: "Birla Building", 13<sup>th</sup> Floor 9/1 R.N. Mukherjee Road, Kolkata -700011  
Telephone No.: 033 2242-0832/4082-3700; Fax No.: 033 2248-0055  
Email: hmcosecy@hindustanmotors.com; Website address: www.hindustanmotors.com

**NOTICE**  
Pursuant to Regulations 29 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, the 10<sup>th</sup> November, 2020 to, inter-alia, consider and approve the Unaudited Financial Results of the Company for the Second Quarter ended 30<sup>th</sup> September, 2020.  
The above information is also available on the website of the Company ([www.hindustanmotors.com](http://www.hindustanmotors.com)), the BSE ([www.bseindia.com](http://www.bseindia.com)) & NSE ([www.nseindia.com](http://www.nseindia.com)).  
FOR HINDUSTAN MOTORS LIMITED  
Sd/-  
Prativa Sharma  
Company Secretary  
Date: 02.11.2020

**CHL LIMITED**  
CIN: L55101DL1979PLC009498  
Regd. Office: Hotel The Surya, New Friends Colony, New Delhi 110025  
Tel.: 91-11-26835070, 4780800 Fax: 26832628  
E-mail: chl@chl.co.in

**NOTICE**  
Notice is hereby given that pursuant to Regulations 29 and 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting of the Board of Directors of the Company will be held on **Thursday, the 12<sup>th</sup> November, 2020 at 01:30 PM**, at Hotel The Surya, New Friends Colony, New Delhi 110025, to inter alia, consider and elect/select Chairman of the Board Meeting and approve the Unaudited Financial Statements (Standalone and Consolidated) of the Company for the Second Quarter and Half-Year ended on 30<sup>th</sup> September, 2020. The same notice may be accessed on the Company's website at [www.chl.co.in](http://www.chl.co.in) and website of the Bombay Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com).  
By Order of the Board  
For CHL Limited  
Sd/-  
G. J. Varadarajan  
Company Secretary  
Place : New Delhi  
Date : 03<sup>rd</sup> November, 2020

**PUBLIC NOTICE**

NOTICE is hereby given that the Share Certificate for 80 (eighty) Equity Shares under Folio No. 01494392, having Certificate No. 9628 and Distinctive Nos. from 289216645 to 289216724 of M/s. HEXAWARE TECHNOLOGIES LIMITED standing in the name of Late JAYCHAND JANARDHAN ADHVARYU have been lost or mislaid and the undersigned have applied to the Company to issue Duplicate Share Certificate for the aforesaid shares. Any person who has a claim in respect of the said shares should lodge such claim with the Company at its Registered Office at 152, Millennium Business Park, Sector - 3, A Block, TTC Industrial Area, Mahape, Navi Mumbai, Maharashtra, 400 071, within 21 days from this date else the Company will proceed to issue duplicate certificate.  
Date : 04/11/2020  
Place : Bharuch, Gujarat.  
Name of the Applicant/Legal Heir (ARUN JAICHAND ADHVARYU)

**Public Notice**

Notice is hereby given that I, Ketan Bhanuchandra Mehta residing at 601/602, Umia Baug Chs Ltd., Nande Patkar Road, Vileparle (East), Mumbai - 400 057, the legal heirs of Late Shree Bhanuchandra Nagardas Mehta who died on 12/01/1992 have lost / misplaced the share certificate nos. 7750, 7751 and 4450, Distinctive nos. 883871 to 885070, 885071 to 888070 and 65745457 to 65747976. For 6720 equity shares of face value Rs. 1/- paid-up under folio no. B05521 registered in the name of Bhanuchandra Nagardas Mehta in the books of Bliss GVS Pharma Limited (formerly known as Bliss Chemicals & Pharmaceuticals India Limited) having Registered Office at 102, Hyde Park, Sakivhar Road, Andheri - East, Mumbai - 400 072, India, and have applied to the Company for issue of duplicate share certificate(s). Any person having claim/objection can write to the company within 15 days from the date of publication of this notice, else the company will proceed to issue duplicate share certificates in my/our favour.  
Date: 04/11/2020 Place : Mumbai

**PUBLIC NOTICE**

I on behalf of our client is investigating the title of MR. JAY RAKESH SHAH (intending purchaser) in respect of their property being Flat No. 303, 3rd floor, Icha-Katir Co-op. Hsg. Society Ltd., Shri Yashwantrao Temple Complex, Devidas Lane, Borivali(West), Mumbai-400 103 bearing CTS No.2405 of Village Eksar (the said property is now mortgaged with Union Bank of India). The intending purchaser has informed us that the all the previous linking agreement prior to Agreement for Sale dated 09/07/2012 and Share Certificate No. 08 were lost and/or misplaced. 1. Agreement for Sale dated 27/03/1995 made between Harkishan Developers (formerly known as Harkishan Investment & Trading Pvt. Ltd. and the CFCO Ltd., 2. Agreement for Sale dated 09/04/1998 made between CFCO Ltd. and Mrs. Manjula Shantilal Kothari, duly registered under registration No. BBJ-3697-98 dated 10/09/1998, 3. Original Share Certificate No. 8 issued by the said Society in favour of Mrs. Manjula Shantilal Kothari dated 22/06/2012 was lost and misplaced then the said Society has issued another Share Certificate No. 12 in the name of Mr. Chirag Bipinkumar Doshi & Mrs. Chetana Chirag Doshi dated 04/01/2015. Any person having any claims or rights in respect of the said premises by way of inheritance, share, sale, license, gift, mortgage, charge, possession, lease, assignment, lien, ownership, transfer, access, easement, encumbrances howsoever or otherwise and/or having possession of the aforesaid documents and/is hereby requested to make the same known in writing to the undersigned within 7 (Seven) days from the date of publication of this notice of his/her share of claim. If any, with all supporting documents falling which, it will be assumed that there are no claims or issues in respect of the said premises and that the said document shall be treated as irretrievable and/or lost. Komal N. Jain, Advocate (High Court) Shop No. 60, Ground floor, Upper Level, Evershine Mall, Mindspace, Malad (West), 400064

"Form No. INC-25A"  
Advertisement to be published in the newspaper for conversion of public company into a private company Before the Regional Director, Ministry of Corporate Affairs North Western, Region In the matter of the Companies Act, 2013, section 14 of Companies Act, 2013 and rule 41 of the Companies (Incorporation) Rules, 2014  
AND  
In the matter of M/s. NOVEL CORPORATION LIMITED having its registered office at C-1175, PATDI CORPORATION LTD, R.K.T.M, NAWABWADI, RING ROAD, SURAT - 395002, GUJARAT, INDIA, ...Applicant  
Notice is hereby given to the general public that the company intending to make an application to the Central Government/Regional Director under section 14 of the Companies Act, 2013 read with aforesaid rules and is desirous of converting into a private limited company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 20th October, 2020 to enable the company to give effect for such conversion. Any person whose interest is likely to be affected by the proposed change/status of the company may deliver or cause to be delivered or send by registered post his objections supported by an affidavit stating the nature of his interest and grounds of opposition to the concerned Regional Director North Western Region, Roc Bhavan, Opp Rupal Park Society, Behind Ankur Bus Stop, Naranpura, Ahmedabad-380013 (Gujarat), within fourteen days from the date of publication of this notice with a copy to the applicant company at its registered office at the address mentioned below:  
For and on behalf of the Applicant  
HARESHKUMAR KUNVARJIJI MANIA  
DIRECTOR  
DIN - 06370364  
Registered Office: C-1175, Patdi Corporation Ltd, R.K.T.M, Nawabwadi, Ring Road, Surat - 395002 Gujarat, India  
Date : 04.11.2020  
Place : Surat

**ALOK INDUSTRIES LIMITED**  
Regd. Office: 17/5/1, 52/1/1, Village Fakholi/Saily, Silvassa- 396230, Union Territory of Dadra & Nagar Haveli  
Tel No.0260-8637000; Fax No.0260-2945289  
CIN:L17110DN1986PLC003034

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Thursday, November 12, 2020 inter alia to consider and approve the standalone and consolidated unaudited financial results of the Company for the quarter and half-year ended September 30, 2020. The said Notice may be accessed on the Company's website at <http://www.alokind.com> and may also be accessed on the Stock Exchange websites at <http://www.bseindia.com> and <http://www.nseindia.com>.  
For Alok Industries Limited  
Sd/-  
K.H. Gopal  
Company Secretary  
Place: Mumbai  
Date : 04.11.2020

**ARIES AGRO LIMITED**  
Registered Office, Aries House, Plot No. 24, Deonar, Govandi (East), Mumbai - 400 043.  
Website: [www.ariesagro.com](http://www.ariesagro.com)  
Email Id: [investorrelations@ariesagro.com](mailto:investorrelations@ariesagro.com)  
(CIN No.-L98999MH1986PLC014465)

**NOTICE**  
Pursuant to the provisions of Regulation 29(1) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Thursday, 12<sup>th</sup> November, 2020 to, inter-alia, consider and approve the Un-Audited Financial Results for the Quarter and Half Year ended 30<sup>th</sup> September, 2020.  
For Aries Agro Limited  
Sd/-  
Qaiser P. Ansari  
Company Secretary & Compliance Officer  
Place : Mumbai  
Date : 3<sup>rd</sup> November, 2020

**MUMBAI SUBURBAN REGIONAL OFFICE**  
3<sup>rd</sup> Floor, NCL Building, Bandra Kuria Complex, Bandra (East), Mumbai-400051

**INVITATION OF BIDS/OFFERS FOR PREMISES ON LEASE**  
Central Bank Of India requires premises admeasuring 1500 to 1800 sq. ft. carpet area in ready possession/ ready for possession within 3 months in and around  
1. 3rd Road at Khar West  
on the ground floor with adequate parking space for shifting of our Khar West Branch. No brokers or intermediaries please. Priority will be accorded to Government/Semi Govt. bodies or public sector undertakings. Kindly download the formats/terms and conditions from the website  
<http://www.centralbankofindia.co.in> or collect the same from Central Bank Of India Mumbai Suburban Regional Office at 3<sup>rd</sup> floor, NCL Building, Bandra Kuria Complex, Bandra East, Mumbai-400051 during office hours. The last date for submission of offers at Mumbai Suburban Regional office at 3<sup>rd</sup> floor, NCL Building, Bandra Kuria Complex, Bandra (East), Mumbai- 400051 is 18/11/2020 up to 2.30 p.m.  
Bank reserves the right to reject any/all offers without assigning any reason whatsoever.  
Regional Manager  
MSRO, BKC

**BLUE CHIP TEX INDUSTRIES LIMITED**  
CIN: L17100DN1986PLC005561  
Registered Office: Plot No. 63-B, Danudiyog Sahakar Sangh Ltd, Village Piparia, Silvassa 396 230, Dadra & Nagar Haveli  
Email Id: [bluechiptex@gmail.com](mailto:bluechiptex@gmail.com)  
Tel. No.: 91-992442247/91-22-43530400

**NOTICE**  
Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of the Company will be held through video conferencing on Thursday 12<sup>th</sup> November, 2020 at 3:00 p.m. to consider and approve the Un-Audited Financial Results for the quarter and half year ended 30<sup>th</sup> September, 2020, with limited review report thereon by the Statutory Auditors of the Company.  
By order of the Board,  
For Blue Chip Tex Industries Limited  
Sd/-  
Bhumi M. Dharwad  
Company Secretary & Compliance Officer  
Mem no.: ACS 51555  
Place: Mumbai  
Date: 3<sup>rd</sup> November, 2020  
For more information please visit: [www.bseindia.com](http://www.bseindia.com)  
[www.bluechiptexindustrieslimited.com](http://www.bluechiptexindustrieslimited.com)

**INLAND PRINTERS LIMITED**  
Reg. Off.: 800, Sangita Ellipse, Sahakar Road, Vile Parle (East), Mumbai-400057 Tel.: (022)-40482500  
Email: [inlandprinters@gmail.com](mailto:inlandprinters@gmail.com)  
CIN: L99999MH1978PLC020739  
Website: [www.inlandprinters.in](http://www.inlandprinters.in)

**NOTICE**  
Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, 12<sup>th</sup> November, 2020 inter-alia to consider and approve Un-audited Financial Results for the Quarter ended 30<sup>th</sup> September, 2020. The information contained in this notice is also available on the company's website [www.inlandprinters.in](http://www.inlandprinters.in) as also on the website of BSE Ltd [www.bseindia.com](http://www.bseindia.com).  
For Inland Printers Limited  
Sd/-  
Bhavesh Patel  
Director  
Date: 03.11.2020  
Place: Mumbai

**ANDHRA PRADESH TANNERIES LIMITED**  
Regd. Office : Leather Complex Area, Nellimarla- 535217.  
CIN- L19110AP1974PLC001711  
Email:- [sugandha78@rediffmail.com](mailto:sugandha78@rediffmail.com)  
Phone:- 022-24934923  
Fax:- 022-24934924  
Website: [www.apptl.in](http://www.apptl.in)

Pursuant to the Regulation 47 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Thursday, November 12, 2020 to inter-alia consider and to approve the Unaudited Financial Results for the quarter and half year ended 30.09.2020. The notice of board meeting is uploaded on the website of the company at [www.apptl.net.in](http://www.apptl.net.in) and also on the website of the Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com).  
For and on behalf of the Board,  
For Andhra Pradesh Tanneries Limited  
Sd/-  
Sugandha Shelatkar  
Director  
Place: Mumbai DIN: 06906156  
Date: 02.11.2020

**Gillette India Limited**  
CIN: L28931MH1984PLC267130  
Registered Office : P&G Plaza, Cardinal Gracias Road, Chakala, Andheri (E), Mumbai 400 099 .  
Tel: (91-22) 2826 6000; Fax: (91-22) 2826 7337. Website: [im.pg.com](http://im.pg.com)  
Investor helpline nos.: 86575 12368 / 86575 00524

**NOTICE**  
NOTICE is hereby given that the Thirty-Sixth Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on **Wednesday, November 25, 2020, at 11.00 a.m.**, through Video Conference ("VC") or Other Audio Visual Means ("OAVM") in compliance with the General Circular numbers 20/2020, 14/2020, 17/2020 issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "the Circulars") without the physical presence of members, at a common venue, in view of the massive outbreak of the COVID-19 pandemic, to transact the business set out in the Notice calling the AGM.  
In accordance with, the General Circular No. 20/2020 dated 5<sup>th</sup> May, 2020 issued by MCA and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12<sup>th</sup> May, 2020 issued by SEBI, the Annual Report for the Financial Year 2019-20, including the Notice of AGM have been sent in electronic mode to Members on November 2, 2020 whose e-mail address is registered with the Company. The copy of the Notice along with the Annual Report is also available on the Company's website: <https://in.pg.com/india-investors/gil/shareholder-information/info#annual-report> as well as on the websites of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and National Stock Exchange of India Limited at [www.nseindia.com](http://www.nseindia.com).  
Instructions for joining the AGM through VC are provided in the notice convening the AGM. Participation of members through VC/OAVM will be reckoned for the purpose of quorum for the AGM as per section 103 of the Companies Act, 2013.  
Shareholders who would like to express their views/have questions, may register themselves as a speaker by sending their request in advance mentioning their name, demat account number/ folio number, E-mail id, mobile number at [investorgil.im@pg.com](mailto:investorgil.im@pg.com) from the date of this notice up to November 22, 2020 (5:00 p.m. IST). Those Members who have registered themselves as a speaker will only be allowed to express their views/ask questions during the AGM. The Company reserves the right to restrict the number of speakers and number of questions depending on the availability of time for the AGM.  
All documents referred to in the Notice will also be available for electronic inspection without any fee by the members from the date of circulation of this Notice up to the date of AGM, i.e. November 25, 2020. Members seeking to inspect such documents can send an email to [investorgil.im@pg.com](mailto:investorgil.im@pg.com).  
NOTICE is also hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rules framed there under, the Register of Members and the Share Transfer books of the Company will remain closed from **Thursday, November 19, 2020, to Wednesday, November 25, 2020 (both days inclusive)**, for the purpose of determining the names of Members eligible for final dividend on Equity Shares, if declared at the 36<sup>th</sup> AGM.  
In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules framed there under and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing facility of remote e-voting to its Members in respect of the business to be transacted at the AGM. The remote e-voting period commences on **Friday, November 20, 2020 at 9:00 a.m. and ends on Tuesday, November 24, 2020 at 5:00 p.m.** During this period, Members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on November 18, 2020, may cast their vote electronically. The e-voting module shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by a Member, he shall not be allowed to change it subsequently. The Company has appointed M/s. Saraf & Associates, Practicing Company Secretaries, represented by Mr. Kamalax Saraf, Proprietor to act as the Scrutinizer, for conducting the scrutiny of the votes cast.  
A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the **cut-off date, i.e., Wednesday, November 18, 2020** only shall be entitled to avail the facility of remote e-voting or for participation at the AGM and voting thereafter. Instructions and procedure for e-voting are set out in the notice of the AGM. Those who have not registered their e-mail addresses, for e-voting may follow the instructions mentioned below:  
• In case shares are held in physical mode please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to [info@masserv.com](mailto:info@masserv.com) and [investorgil.im@pg.com](mailto:investorgil.im@pg.com);  
• In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to [info@masserv.com](mailto:info@masserv.com) and [investorgil.im@pg.com](mailto:investorgil.im@pg.com).  
In case of any queries, on e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of [www.evoting.ndsl.co.in](http://www.evoting.ndsl.co.in) or call on toll free no.: 1800-222-990 or send a request to [evoting@ndsl.co.in](mailto:evoting@ndsl.co.in)  
Members are requested to register / update bank details to enable electronic modes of transfer for dividends and in this regard:  
• Members holding shares in electronic form are requested to furnish their bank details to their Depository Participants ("DPs").  
• Members holding shares in physical form are requested to furnish their bank details, alongwith a photocopy of a blank cancelled cheque pertaining to their bank account to the Registrar and Share Transfer Agent, ("RTA"), M/s. MAS Services Ltd.  
For instructions on joining the AGM, manner of casting vote through remote e-voting or e-voting during the AGM, members are requested to refer to the Notice of the AGM.  
Further, Shareholders may note that, in accordance with the provisions of the Income Tax Act, 1961 ("the Act") as amended by and read with the provisions of the Indian Finance Act, 2020, dividend declared and paid by the Company after April 1, 2020, is taxable in the hands of shareholders and the Company is required to deduct the tax at source ("TDS") on the distribution of dividend income to its shareholders at the applicable rates. In order to enable us to determine the appropriate TDS rate as applicable, shareholders are requested to submit the requisite documents as mentioned in our letter dated September 28, 2020, which is put up on the website at <https://in.pg.com/india-investors/gil/reports-announcements/announcements/#announcements>, in order facilitate company to deduct TDS at time of final dividend. The said documents (duly completed and signed) are required to be emailed to Company's RTA at [info@masserv.com](mailto:info@masserv.com) on or before **November 15, 2020** in order to enable the Company to determine and deduct appropriate TDS. For any clarification, please write to us at [info@masserv.com](mailto:info@masserv.com) or [investorgil.im@pg.com](mailto:investorgil.im@pg.com).  
By Order of the Board  
For Gillette India Limited  
Sd/-  
Ghanashyam Hegde  
Company Secretary  
Place : Mumbai  
Date : November 3, 2020

**Form No. INC-26**  
[Pursuant to rule 30 of the Companies (Incorporation) Rules, 2014]  
Advertisement to be published in the newspaper for change of registered office of the company from one state to another  
Before the Central Government Western Region  
In the matter of sub-section (4) of Section 13 of Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014 AND  
In the matter of MONARCH NETWORK CAPITAL LIMITED having its registered office at 901/902, 9<sup>th</sup> Floor, Atlanta Centre, Sonawala Road, Near Udyog Bhawan, Goregaon (East), Mumbai -400063, .....Petitioner  
Notice is hereby given to the General Public that the company proposes to make application to the Central Government under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed by the Company through Postal Ballot on 1<sup>st</sup> November, 2020 to enable the company to change its Registered Office from "State of Maharashtra" to "State of Gujarat".  
Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the company may deliver either on the MCA-21 portal ([www.mca.gov.in](http://www.mca.gov.in)) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director at Everest 5<sup>th</sup> Floor, 100 Marine Drive, Mumbai - 400002 within fourteen days of the date of publication of this notice with a copy to the applicant company at its registered office at the address mentioned below:  
MONARCH NETWORK CAPITAL LIMITED - 901/902, 9<sup>th</sup> Floor, Atlanta Centre, Sonawala Road, Near Udyog Bhawan, Goregaon (East), Mumbai-400063  
For MONARCH NETWORK CAPITAL LIMITED  
Sd/-  
VAIBHAV SHAH  
DIN: 00572666  
MANAGING DIRECTOR

**LANCER CONTAINER LINES LIMITED**  
Mayuresh Chambers Premises Co-Operative Society Ltd.,  
Unit No. H02-2, H02-3 & H02-4, Plot No. 60, Sector-11,  
G.D. Bopara, Navi Mumbai-400614  
Tel. No. - 91 22 27566940/42 E-Mail Id: [secretarial@lancer-marine.in](mailto:secretarial@lancer-marine.in);  
Website : [www.lancer-marine.in](http://www.lancer-marine.in) ; CIN : L74900MH2011PLC124448

**NOTICE**  
Notice is hereby given that pursuant to applicable regulations of SEBI (Listing obligation and Disclosure Requirements) Regulation, 2015, a meeting of the Board of Directors of the company is scheduled to be held on **Tuesday, November 10, 2020** at Navi Mumbai inter alia, to consider and approve the Un-Audited Financial Results of the Company, for the Quarter and Half Year ended September 30, 2020 and any other business matter, with permission of chair. This notice is also available on the website of the company [www.lancer-marine.in](http://www.lancer-marine.in) and on the website of the stock exchange [www.bseindia.com](http://www.bseindia.com).  
For Lancer Container Lines Limited  
Sd/-  
Abdul Khalik Chataiwala  
Chairman & Managing Director  
DIN : 01942246  
Place : Navi Mumbai  
Date : November 03, 2020

**Galaxy Surfactants Limited**  
CIN: L39877MH1986PLC039877  
Registered office: C-49/2, TTC Industrial Area, Pawne, Navi Mumbai - 400 703, Maharashtra, India  
Tel: +91 22 2761 6666, Fax: +91 22 2761 5883/2761 5886  
Email: [investorservices@galaxysurfactants.com](mailto:investorservices@galaxysurfactants.com);  
Website: [www.galaxysurfactants.com](http://www.galaxysurfactants.com)

In terms of Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, November 11, 2020, inter-alia, to consider and approve the Unaudited Financial Results (Consolidated and Standalone) of the Company for the quarter and half ended September 30, 2020. This information is available on the Company's website ([www.galaxysurfactants.com](http://www.galaxysurfactants.com)) and also on website(s) of BSE Limited ([www.bseindia.com](http://www.bseindia.com)), National Stock Exchange of India Limited ([www.nseindia.com](http://www.nseindia.com)).  
By order of the Board  
For Galaxy Surfactants Ltd.  
Sd/-  
Niranjan Kelkar  
Company Secretary  
Place: Navi Mumbai  
Date : November 03, 2020

**NOTICE**  
NOTICE is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company will be held on Thursday, November 12, 2020 at Mumbai, inter-alia, to consider and approve the Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the second quarter and half year ended September 30, 2020.  
This information is also posted on the website of the Company i.e. [www.hccindia.com](http://www.hccindia.com) and on the website of the Stock Exchanges, i.e. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com).  
For Hindustan Construction Co. Ltd.  
Sd/-  
Vithal P. Kulkarni  
Company Secretary  
**HCC**  
[www.hccindia.com](http://www.hccindia.com)  
Hindustan Construction Co Ltd  
Registered Office: Hincan House, Lal Bahadur Shastri Marg, Vikhroli (West), Mumbai 400 083, India.  
Tel: +91 22 2575 1000 Fax: +91 22 2577 7668  
CIN: L45200MH1928PLC001228

**ORIENT REFRACTORIES LIMITED**  
(An RHI Magnesita Company)  
CIN : L28113MH2010PLC312871  
Regd. Office : C-604, Neelkanth Business Park, Opp. Railway Station, Vidhyavihar (West), Mumbai, Maharashtra - 400086  
Phone No : +91-22-66090600 ; Fax No : +91-22-66090601  
Email : [Bhi\\_info@RHIMagnesita.com](mailto:Bhi_info@RHIMagnesita.com); Website : [www.orientrefractories.com](http://www.orientrefractories.com)

**Extracts of Unaudited Financial Results for the Quarter and Six months ended September 30, 2020**  
(Amount in Rs. Lacs)

Sl. No.	Particulars	Quarter ended September 30, 2020	Six months ended September 30, 2020	Year ended March 31, 2020	Quarter ended September 30, 2020	Six months ended September 30, 2020	Year ended March 31, 2020
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)
		Consolidated			Standalone		
1.	Total revenue from operations	18,212.78	29,976.26	70,629.65	18,079.80	29,804.49	70,251.97
2.	Net profit before tax #	2,791.02	4,097.17	11,732.97	2,753.66	4,061.56	11,669.75
3.	Net profit after tax #	2,072.37	3,036.19	8,686.55	2,044.41	3,007.28	8,725.08
4.	Total Comprehensive income for the period after tax	2,057.37	3,006.20	8,626.59	2,029.41	2,977.29	8,665.12
5.	Equity share capital (Face value Re. 1/- per share)	1,201.39	1,201.39	1,201.39	1,201.39	1,201.39	1,201.39
6.	Reserves (excluding revaluation reserves)			41,428.78			41,466.41
7.	Basic and Diluted earning per share (of Re. 1/- each) (not annualized)/(in Rs.)	1.73	2.53	7.23	1.70	2.50	7.26

# The Company does not have any extraordinary item to report for the above periods.

**Notes:**  
The above is an extract of the detailed format of quarterly financial results filed with the stock exchanges under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results is available on the website ([www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com)) and on the Company's website ([www.orientrefractories.com](http://www.orientrefractories.com)).  
For & on behalf of the Board of Directors  
Sd/-  
Parmod Sagar  
Managing Director & CEO  
(DIN - 06500871)  
Place : Gurugram  
Date : November 03, 2020

